

--	--	--	--	--	--	--	--	--	--

Sl. No. : 100349

**179(G)**

(March, 2019)

**Time : 3 Hours]**

**[Maximum Marks : 100**

સૂચનાઓ :

- 1) આ પ્રશ્નપત્રમાં કુલ 47 પ્રશ્નો છે.
- 2) બધા જ પ્રશ્નો ફરજિયાત છે. વિકલ્યો આંતરિક છે.
- 3) પ્રશ્નની સૂચના પ્રમાણે જ જવાબ લખવા.

### **વિભાગ - A**

■ નીચે આપેલા 1 થી 10 સુધીના હેતુલક્ષી પ્રશ્નો છે. આપેલ વિકલ્યોમાંથી સાચો (A, B, C) વિકલ્ય પસંદ કરી ફરીથી લખો. દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

**[10]**

- 1) ફક્ત સરવાળાજ નહીં, પરંતુ ગુણાકાર, ભાગાકાર અને બાદબાકી બધુંજ કૃયાં યંત્ર પર થઈ શકે ?  
(A) કોમ્પ્ટોભીટર  
(B) સરવાળા સાથે નોંધ આપતું યંત્ર  
(C) સરવાળા કરનાર યંત્ર
- 2) કૃયાં યંત્રમાં ટાઈપરાઇટર અને ગણતરી કરનાર યંત્રનું મિશ્રણ છે ?  
(A) પરચુરણ આપનાર યંત્રો  
(B) ભરતિયા તૈયાર કરનાર યંત્રો  
(C) રોકડ નોંધનાર યંત્રો
- 3) પુસ્તિકાને છેવટની માન્યતા કોણ આપે છે ?  
(A) મેન્યૂઅલ કમિટી  
(B) ખાતાના અધિકારીઓ  
(C) ઉચ્ચ સંચાલકો

- 4) સભાની નોટિસ સત્યોને કેટલા દિવસ પહેલા આપવી જોઈએ ?
- (A) 21 દિવસ  
(B) 15 દિવસ  
(C) 30 દિવસ
- 5) વેચાણ અધિકારી અને સેલ્સમેનના સંબંધોમાં વેચાણ અધિકારીનો દરજીઓ ....
- (A) સમકક્ષ અધિકારીનો ગણાય  
(B) ઉચ્ચ અધિકારીનો ગણાય  
(C) મદદનીશાનો ગણાય
- 6) કર્મચારીઓ એ નીચેની ઘટના પસંદ ન કરવી જોઈએ ?
- (A) અધિકારીને વહાલા થવું  
(B) તાલિમની તક  
(C) બઢતીની તક
- 7) બાધ્ય પક્ષકારો માટે જનસંપર્ક અધિકારીનું કાર્ય કોના જેવું છે ?
- (A) અધિકારી  
(B) એલચી  
(C) મેનેજર
- 8) સીધી રેખામાં કાર્યપ્રવાહનો એક ફાયદો છે.
- (A) સંદેશા વાહક કાર્ય વધુ  
(B) કાગળો ગુમ થવાની શક્યતા વધુ  
(C) કાર્યની ઝડપ વધુ
- 9) વેપારી અંગત મકાન વેચી રકમ ધંધામાં રોકે ત્યારે ક્યું ખાતું જમા થાય છે ?
- (A) ઉપાડ ખાતું  
(B) મૂડી ખાતું  
(C) મકાન ખાતું

10) જ્યારે ધરખર્ય માટે બેંકમાંથી નાણાં ઉપાડવામાં આવે ત્યારે ત્રણ ખાનાવાળા રોકડ મેળમાં વ્યય બાજુ કયાં ખાનામાં તેની નોંધ થશે?

- (A) વટાવ
- (B) રોકડ
- (C) બેંક

### વિભાગ - B

■ નીચે આપેલા પ્રશ્ન કમાંક 11 થી 20 અતિ દુંકા પ્રશ્નો છે. પ્રશ્નના જવાબ સમજુને લખો. દરેકનો 1 ગુણ છે.

[10]

11) શ્રુતલેખન યંત્રમાં આવતા મુખ્ય ભાગોના નામ આપો.

12) કર્મચારીઓની ગેરહાજરીમાં કયું યંત્ર સંદેશા નોંધવાનું કાર્ય કરે છે?

13) કાર્યાલય પુસ્તિકાના પ્રકારો જણાવો.

14) વ્યક્તિઓના ખાતાં માટેનો નિયમ જણાવો.

15) આમનોંધ એટલે શું?

16) બેંક ખાતાની જમા બાકી એટલે શું?

17) ગુંડર, લાખ, પીન, સ્ટેલર વગેરેને શું કહેવાય?

18) કાર્યાલય પદ્ધતિનો અર્થ આપો.

19) કાર્યાલય કાર્યવાહીનો અર્થ આપો.

20) કાર્યપ્રવાહનું વિશ્લેષણશા માટે આવશ્યક છે?

### વિભાગ - C

■ નીચેના 21 થી 31 સુધીના દુંકા પ્રશ્નો છે. માણ્યા મુજબ જવાબ આપો. દરેક પ્રશ્નના 2 ગુણ છે.

[22]

21) પોસ્ટલ, ફેન્કિંગ મશીનના ફાયદા જણાવો.

22) 'કાર્યાલય પુસ્તિકા સાધન છે; સાધ્ય નથી' - સમજાવો.

- 23) 'કાર્યાલય પુસ્તિકાઓ ખર્ચણ છે' - સમજવો.
- 24) આર્થિક વ્યવહારો એટલે શું ? કયાં પ્રકારના વ્યવહારોની ચોપડે નોંધ થાય છે ?
- 25) ખાતાની બાકી એટલે શું ? - સમજવો.
- 26) કુશળ સેકેટરી કંપનીની સફળતાની ચાવી છે - સમજવો.
- 27) સેકેટરી કંપનીનો નોકર છે અને સાથે કાયદાનો પણ નોકર છે - સમજવો.
- 28) સ્ટેશનરી સ્ટોક ગણવાની પદ્ધતિઓનાં નામ જણાવો.
- 29) સ્ટેશનરી અને પુરવઠાનો યોગ્ય સંગ્રહ કરવાથી આપ ક્યા ધ્યેયો પ્રાપ્ત કરી શકશો ?
- 30) કાર્યાલય પદ્ધતિઓના આયોજનના તબક્કા જણાવો.
- 31) ડૉ. જ્યોર્જ આર. ટેરીએ કર્મચારી સંચાલનમાં કઈ બાબત પર ભાર મુક્યો છે ?

### વિભાગ - D

■ નીચેના 32 થી 42 સુધીના લઘુ પ્રશ્નો છે. માણ્યા મુજબ જવાબ આપો.  
દરેક પ્રશ્નોના 3 ગુણ છે.

[33]

- 32) કાર્યાલય યાંત્રિકરણ માટેના મહત્વના પરિબળો જણાવો.

અથવા

કાર્યાલય યાંત્રિકરણના ફાયદાઓ વર્ણવો.

- 33) ગણતરી અને હિસાબને લગતા યંત્રો જણાવી કોમ્પ્યુટર પર નોંધ આપો.
- 34) સામાન્ય માહિતીદર્શિકા વિશે ટૂંકનોંધ લખો.

અથવા

કાર્યાલય પુસ્તિકામાં આપ કઈ કઈ બાબતોનો સમાવેશ કરશો ?

- 35) વ્યવસ્થાતંત્રની પુસ્તિકા ઉપર ટૂંકનોંધ લખો.
- 36) ખાતાના પ્રકારો જણાવી ઉધાર-જમાના નિયમો ઉદાહરણ આપી જણાવો.

અથવા

રોકડ વટાવ અને વેપારી વટાવનો તફાવત આપો.

- 37) નામાનો અર્થ આપી નામાની ઉપયોગિતા જણાવો.
- 38) ખાસ ઠરાવની શરતો જણાવી, કયાં કાર્યો કરવા તે જરૂરી છે ?
- 39) કાર્યાલય સ્ટેશનરી ખરીદીની પ્રક્રિયા સમજાવો.
- 40) સ્ટેશનરી અને પુરવઠાની અંકૂશ માટેની કાર્યવાહી વર્ણવો.
- 41) અસરકારક કાર્યાલય પદ્ધતિની રચના કરવા આપ કયાં પગલા સૂચવશો ?
- 42) મદદનીશ કે તાબેદાર તરીકેની તમારી વર્તણૂક કઈ હોઈ શકે ?

### વિભાગ - E

■ નીચેના પ્રશ્ન ક્રમાંક 43 થી 47 નિખંખ પ્રકારના પ્રશ્નો છે. માંગ્યા મુજબ જવાબ આપો.  
દરેકના 5 ગુણ છે.

[25]

- 43) સામાન્ય ઉપયોગમાં લેવાતા ગમેતે ચાર યંત્રોના કાર્ય અને મહત્વનો ઘ્યાલ આપો.

અથવા

ટાઇપરાઇટરના પ્રકારો જણાવી ગમે તે ચાર ટાઇપરાઇટરની સમજૂતી આપો.

- 44) કાર્યાલય પુસ્તિકાની વ્યાખ્યા આપી તેના ફાયદાઓ જણાવો.

અથવા

કાર્યાલય પુસ્તિકાની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો.

- 45) સભાનોંધ એટલે શું ? તે અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો.
- 46) કાર્યાલય કાર્યમાં સ્ટેશનરી અને પુરવઠાની જરૂરિયાત અને મહત્વની ચર્ચા કરો.
- 47) નીચે આપેલ 'શ્રીવા શાહ' સ્ટોર્સના વ્યવહારોને બેંક અને રોકડખાનાવાળા રોકડમેળમાં નોંધો અને બાકી કાઢો.

2015

માર્ચ 1 રોકડ સિલક રૂ. 11,000; બેંક સિલક રૂ. 6,000

માર્ચ 5 રોકડ ખરીદી રૂ. 1,000; રોકડ વેચાણ રૂ. 2,000

- માર્ચ 7 શ્રી હસુમતીબેન શાહ પાસેથી રૂ. 5,000 નો ચેક મળ્યો જે બેંકમાં  
ભર્યો.
- માર્ચ 9 શ્રી ગંગબેન પગારના રૂ. 400 ચેકથી ચુકવ્યા.
- માર્ચ 12 બેંકમાંથી રૂ. 4,000 દુકાનખર્ચ માટે અને રૂ. 5,000 ઘરખર્ચ માટે  
ઉપાડ્યા.
- માર્ચ 15 શ્રી દિલીપભાઈ શાહને રૂ. 4,000 નો માલ વેચ્યો, બદલામાં ચેક  
મળ્યો જે બેંકમાં ભર્યો.

